



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૦૮/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૨૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૦ કેસ કરી, ૪૫ વ્યક્તિઓને ઝડપી, ૧૪૦ લીટર દેશી દારૂ, ૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૦,૨૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૨૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

તાજી જન્મેલ બાળકી બીનવારસી મળી આવી :-

સમાચાર યાદી નં.૧૩૨૫/૧૯

સરદારનગર : સંદિપભાઈ હરગોવીંદદાસ ઉદાસી (૨૬,શ્યામશરણ એપાર્ટમેન્ટ ટોચટા શો-રૂમ ની બાજુમા નાના ચિલોડા) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૮/૨૦૧૯ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે સરદારનગર કુબેરનગર રાજલક્ષ્મી સોસાયટી સિંઘી કોલોનીની સામે મોટી કંપાઉન્ડની બાજુમાં ખુલ્લા પ્લોટમાંથી તાજી જન્મેલી જીવીત બાળકી બીનવારસી ત્યજી દિઘેલ હાલતમાં મળી આવેલ હોઇ સરદારનગર પોલીસે અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.કે.મોથલીયા ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૨૬/૧૯

નારણપુરા : ધવલભાઈ દિપકભાઈ ત્રીવેદી (૨૬.નારણપુરા ગામ રાધાકીજ્ઞા મંદિરની લાઇનમાં) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૮/૨૦૧૯ ના કલાક ૧૨/૦૦ થી તા.૦૫/૦૮/૨૦૧૯ ના કલાક ૮/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૬૪,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એચ.કે.મકવાણા ચલાવે છે.

જીઆઈડીસી વટવા: મીનાબહેન વા/ઓ અમરીશભાઈ પંચાલ (રહે. ઉમંગ એપાર્ટમેન્ટ સાંઇબાબા મંદિર પાસે જશોદાનગર)એ તા.૫/૮/૧૯ નારોજ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨/૮/૧૯ સવારના ૯/૦૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા ૧,૯૫,૦૦૦/- મતાના ચોરી કરી લઇ ગઇ છે. આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી સી.એમ.રાહોડ યલાવે છે.

સોનાની ચેઇન ખેચી તોડી લઇ ગયો :-

સમાચાર યાદી નં.૧૩૨૭/૧૯

મણીનગર : ધર્મશભાઈ હરીપ્રસાદ વ્યાસ (ઉ.વ.૪૫)(રહે.ચંદ્રીકા સોસાયટી ગોરધનવાડી ટેકરો પુષ્પકુંજ કાંકરીયા મણીનગર) તા.૦૫/૦૮/૨૦૧૯ ના કલાક ૮/૫૦ વાગ્યાના સુમારે મણીનગર કૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલ “રાજ જાપાન મોબાઇલ શોપ” દુકાન સામે રોડ ઉપરથી પોતાનું એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ (૩૦ વર્ષના આશરાનો) ધર્મશભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેચી તોડી લઇ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ ધર્મશભાઈ વ્યાસ એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ટી.એન.મોરડિયા યલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૨૮/૧૯

વાડજ: માધાજીભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.૭૨) (રહે. શ્યામ એપાર્ટમેન્ટ ચાંપાનેર સોસાયટી ઉસ્માનપુરા) એ અગમ્ય કારણસર તા.૫/૮/૧૯ સાંજના ૫/૨૦ વાગ્યાના સુમારે પોતાના રહેણાંકના ઘાબા ઉપરથી પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે વાડજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી જી.એન.સુથાર યલાવે છે.

રીવરફ્રંટ ઈસ્ટ: રોહીતભાઈ લાલજીભાઈ ધવડ (ઉ.વ.૩૫) (રહે.આંબેડકરનગરની ચાલી રામાપીરનો ટેકરો નવાવાડજ) એ અગમ્ય કારણસર તા.૪/૮/૧૯ સાંજના ૭/૫૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે દધીચીબ્રીજ નીચે દશામાના મંદિર તરફ રીવરફ્રંટ વોક-વે નજીક નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રંટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ યલાવે છે.

વાસણા: રાજેન્દ્રભાઈ જગદીશભાઈ માહોર (ઉ.વ.૩૬) (રહે.શ્રીનગર સોસાયટી પ્રતાપકુંજ સોસાયટી પાછળ વાસણા) એ અગમ્ય કારણસર તા.૫/૮/૧૯ સાંજના ૬/૦૦ થી ૬/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જગદીશભાઈ નારણભાઈ યલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.